

MGEL/CS/NSE/2020-21/30

Date: 25th July, 2020

To,
Listing Compliance Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra,
Mumbai-400 051, Maharashtra.

Company Symbol: MGEL (NSE Emerge), ISIN: INE0APB01016

Subject: Newspaper Advertisement confirming dispatch of Notice of 10th Annual General Meeting and Annual Report of the Company for the Financial Year 2019-20.

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copy of Newspaper Advertisements published in Indian Express- Ahmedabad Edition (in English) on 24th July, 2020 and Financial Express - Ahmedabad Edition (in Gujarati) on 25th July, 2020 confirming dispatch of Notice of 10th AGM and Annual Report for the Financial Year 2019-20.

The said newspaper advertisement has also been uploaded on the website of the Company at www.groupmangalam.com.

In accordance with General Circular No. 17/2020 dated 13th April, 2020 read with General Circular No. 20/2020 dated 5th May, 2020 issued by Ministry of Corporate Affairs and in view of current extra-ordinary circumstances due to the pandemic caused by Covid-19 prevailing in the country, the Company has not sent hard copy of the Notice of 10th AGM and Annual Report to the shareholders.

Kindly take the same on your record.

Thanking You.

Yours faithfully,
For Mangalam Global Enterprise Limited



Vrunda Patel
Company Secretary & Compliance Officer



Enclosed: A/a.

Mangalam Global Enterprise Limited

CIN: L24224GJ2010PLC062434

Regd. Office: 101, Mangalam Corporate House, 19/B, Kalyan Society, Near M.G. International School,
Mithakhali, Ahmedabd-380006, Gujarat (INDIA) Tel: +91 79 61615000 (10 Lines) E mail:

info@groupmangalam.com

copy for Bobb PR

GCMMF elects its new chairman and vice-chairman

EXPRESS NEWS SERVICE
VADODARA, JULY 23

GUJARAT COOPERATIVE Milk Marketing Federation (GCMMF) has elected Shamal Patel of Sabar Dairy as its chairman and Valamji Humal of Kutch Dairy as its vice-chairman in the elections held Thursday, after the stipulated period of two-and-half years.

Outgoing chairman Ramsinh Parmar, who is the chairman of Kaira milk union proposed Patel's name and was supported

by former Cabinet Minister Shankarbai Chaudhary, who is the chairman of Banas milk union. Similarly, outgoing vice-president Jetha Bharwad, chairman of Panchmahal milk union, proposed Humal's name and received support from Mohan Bharwad, chairman of Ahmedabad milk union, a release said.

Both Patel and Humal were unanimously elected in the election presided over by the deputy collector of Anand district in presence of the 18 member cooperatives of the state—represented by

their respective chairmen. Both Patel and Humal are affiliated to the BJP, which has gained much control over the dairies across the state in recent years. Sources said that while Banas Dairy chairman Chaudhary was also a front runner along with Parmar, who was seeking a second term, Patel's election was proposed on the basis of the performance of the Sabar Dairy in the last financial year.

Patel is the chairman of Sabarkantha District Cooperative Milk Producers Union Ltd., (Sabar dairy) and has

been associated with dairy cooperatives of Gujarat for the last 30 years. Sabar Union is one of the largest dairy unions of the state with an annual sales turnover exceeding Rs 5,700 crore and membership of 3.8 lakh milk producers, the release said. Humal is the chairman of Kutch District Cooperative Milk Producers Union Ltd., Sarhad Dairy, since last 11 years. Kutch milk union as an annual sales turnover exceeding Rs 550 crore and farmer membership of one lakh milk producers.

After being elected, Patel

said, "Dairy cooperatives of Gujarat have been successful since the last seven decades due to high values and standards set by its founder leaders like Tribhuvandas Patel and Dr Verghese Kurien. The combination of dynamic farmer leadership and professional management has made the federation the largest food organization in the country."

Humal mentioned that India has become the largest

milk-producing country in the world due to the replication of Amul model across the country. "GCMMF will continue to work in close coordination with all to strengthen the cooperative movement and also support milk producers of other states if such a need arises," Humal said.

Parmar, a former Congress MLA from Thasra in Kheda, had joined the BJP in January 2018 before being elected as the GCMMF chairman.

Four detained for accepting bribe

Rajkot: A junior town-planner, retired draughtsman of Surendranagar, a sanitary worker and an apprentice of Rajkot Municipal Corporation were detained by

Anti-Corruption Bureau for allegedly taking bribe in two cases. ACB will get the Covid-19 tests done and if they test negative, they will be arrested, officers said. ENS

TENDER NOTICE NOSK-1 OF 2020-21
Online Tenders are invited by Executive Engineer, Ahmedabad Medical (R&B) Division, C-4, Bahumali Bhavan, Vastnagar, Ahmedabad-380052 for Total: 3 (Three) works costing approx. Rs.13.18 Lakh to Rs.24.37 Lakh from the Government Contractors registered in appropriate class. Tender documents of these works can be seen on www.rnh.nprocure.com from Dt.23/07/2020. Tenders can be Downloaded/Submitted upto Dt.06/08/2020 at 18.00 hrs. Tenders will not be received by hand to hand / Reg. Post. Detailed Tender Notice can be seen on www.statetenders.com and office Notice Board. Interested Contractors are requested to contact personally at above office in working days for information.


No. INF/ABD/363/2020

GSRTC
GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION
GSRTC invites online tenders
for appointment of operator for operating Electric Buses for GSRTC on Grant Cost Contract Model under FAME India Scheme Phase-II.

As per tender specification, pre-qualification criteria and conditions mentioned in respective RFP. Please visit the website mentioned below for the details regarding submission of tender documents through online e-tender process <https://gem.gov.in>. For further details please contact on Phone No. 079-22801236 (in office hours) email at: cmegsrtc@yahoo.co.in.

CME, GSRTC Ahmedabad

SALUTE THE SOLDIER
MARTYR OF 210 Bn, CoBRA
SI/GD Pradeep Kumar of 210, CoBRA made the supreme sacrifice during an operation in Jungle area of Durama Ranges near Nobolgre-Sabogre jungle area, Under PS: William Nagar, Dist: East Garo Hills (Meghalaya) on 24th July 2012. The CRPF proudly remembers the braveheart who laid down his life at the altar of duty while fighting with militants. His courage and bravery would remain an abiding source of inspiration for the Force.
IG & All Ranks of CoBRA



SURAT MUNICIPAL CORPORATION
DRAINAGE DEPARTMENT
e Tender (On line) invitation Notice No. EE/Drainage/03/2020-21.
Online tenders are invited on <https://smc.nprocure.com> for the various works of drainage department, from the Government approved contractors of relevant class.

S.No	Name of the department	Drainage
2	No of the works	03
3	Total Estimated cost of Tender Rs. in Lacs	49486.86

The detail tender notice will be made available at above address and on website www.suratmunicipal.gov.in

No. PR.O./347/2020-21
Date: 22/07/2020

Executive Engineer & Head of Department
Surat Municipal Corporation

Water and Sanitation Management Organization
WASMO: BHAVNAGAR
If any query regarding water supply Contact on GWSSB Toll free helpline no. 1916.
TENDER NOTICE No. 04 /2020-21
Tender I.D No:- 418161

Chairman, Village Water & Sanitation Committee, TRAPAJ, Tal. Talaja, Dist. Bhavnagar invites Tender for below mentioned work by e Tendering Online Two bid system Name of work: Providing, Supplying, Lowering, Laying and Joining Rising Main DI K-7, Providing, Supplying, Lowering, Laying and Joining 6 kgf/cm2 PVC Pipeline, Pumping Machinery for sump, Construction of RCC U/G Sump, RCC ESR, Pump Room, RCC Cattle Trough, VAP Board & Slogan writing And Three Month Trial run for TRAPAJ village water supply scheme Ta. TALAJA District Bhavnagar UNDER AUGMENTATION OF TAP CONNECTIVITY IN RURAL AREA PROGRAM General Year 2020-21 for detailed information of Tender log on to website <https://nprocure.com>. Note: Any further correction will be uploaded online only.

Event	Submission Date.
Estimated cost Rs. Lacs	Rs.98,36,481.00
Last Date:-On line submission	Up to Dt.13/08/2020 18.00 Hrs.
Submission of Tender fee, EMD (By Reg. Post A.D. or speed post) Last Date.14/08/2020 (15:00)	Tender Fee Rs. 1) 2,400.00 E.M.D. 1 % Rs. 2) 98,400.00
Opening of Tender (Online)	Dt. 14/08/2020 Time 1600 Hrs.
Registration Of Contractor	Class D & above

DDI-BVN-254/20-21

REVENUE DEPARTMENT
SACHIVALAYA, GANDHINAGAR
NOTIFICATION
(The Right to Fair compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act-2013) (SO of 2013)
Dist:-Bharuch Date:-06/07/2020
AM-2020-370-M-LBR-1438-2143 GH
Whereas it appears to the Government of Gujarat that the land specified in the SCHEDULE annexed hereto, to be required for "construction of four land road of Ankleshwar-Pratapnagar-Rajpipla road" (hereinafter referred to as "The public purpose project")

- Now whereas, the Government of Gujarat, Revenue Department has, in exercise of the powers conferred, by section-10 (inserted by section 3 of The Right to Fair compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of 2013) (hereinafter referred to as "The Act") exempted, in public interest, by Notification No-AM-2018-738-M-LBR-1418-2143-GH, dated 25/10/2018 published in the extraordinary Gazette of Gujarat Government Dated 25/10/2018 the below mentioned Scheduled area of land, to be acquired for the infrastructure project of "construction of four land road of Ankleshwar-Pratapnagar-Rajpipla road", form the application of the provisions of chapter II and III of The Act, and
- Now whereas, in exercise of the powers, conferred by sub-section (1) of section-43 of The Act, The Government of Gujarat has appointed, by Notification No-NMK-102017-1238-D1 Dated 25/07/2017, Special Land Acquisition officer, Bharuch as the Administrator of Rehabilitation and Resettlement in respect of the scheduled land to be acquired for construction of the captioned infrastructure project, and
- Now Whereas, in exercise of the powers conferred by sub-section (1) of section 11 of "The Right to Fair compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of 2013) (hereinafter referred to as The Act), the Government of Gujarat, has notified, vide their Notification No-AM-2019-202-M-LBR-1418-2143-GH Dated 07/03/2019 that the said Scheduled land is required for the public purpose specified here above.
- And Whereas, the Government of Gujarat is satisfied after considering the report made by The District Collector, Bharuch under sub-section (2) of section 15 of the Act, that the said land is needed to be acquired for " The public purpose project " specified in the scheduled hereto, and
- Now therefore, in exercise of the power conferred by sub-section (1) of section 19 The Act, the Government of Gujarat hereby declares that the said scheduled lands is required for the public purpose specified in the schedule hereto.
- in exercise of the power conferred by clause (g) of section-3 of The Act, the Government of Gujarat hereby appoints, Special Land Acquisition officer, Bharuch to perform the function of a Collector, for all proceeding hereinafter to be carried out under The Act, in respect of the said scheduled lands.
- The plans of scheduled lands can be inspected at the office of The Special Land Acquisition officer, Bharuch.

SCHEDULE
Brief description of the land to be acquired, falling within the stretch of "construction of four land road of Ankleshwar-Pratapnagar-Rajpipla road"
District:-Bharuch Taluka:Jhagadia Village:-Sarsa

Survey No./Block No	Area H.A.Sq.mt
94-B	0-00-75
95-B	0-00-50
97	0-00-25
98	0-03-22
Total	0-04-72

by order and in the name of the Government of Gujarat.
(H.J.Rathod)
under secretary to Government
(INF/BCH/219/2020-21)

Request For Proposal
Gorakhpur Industrial Development Authority (GIDA) is requesting for proposals from firms/agencies for "Preparation of GIS based Master Plan & sectoral plan for development of Industrial corridor Dhuriyapar of 5500 acres (approx.) area.
The RFP document will be available online on our website <http://www.gidagk.org> (in grievance menu) 27-07-2020 onwards. For details please visit the above-mentioned link. Interested firms/agencies shall submit their response in the prescribed formats along with all the relevant documents on or before 28-08-2020, 17:00 hrs. on the address mentioned below:
Chief Executive Officer,(GIDA)
Gorakhpur Industrial Development Authority (GIDA)
Sec.-7, GIDA, Gorakhpur-273212
Chief Executive Officer

MANGLAM GLOBAL ENTERPRISE LTD.
CIN : L24224GJ2010PLC062434
Registered Office: 101, Mangalam Corporate House, 19/B Kalyan Society, Near M.G. International School, Mithakhali, Ahmedabad-380006, Gujarat, India. Telephone: +91 79 6161 5000; Website: www.groupmangalam.com; Email: cs@groupmangalam.com

NOTICE OF THE 10TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY, RECORD DATE AND E-VOTING
NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Tenth (10th) Annual General Meeting (AGM) of the Members of Mangalam Global Enterprise Limited (Formerly known as Mangalam Global Enterprise Private Limited) will be held on Thursday, 13th August, 2020 at 11:00 A.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 10th AGM.
In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, the Notice of AGM along with Annual Report 2019-20 have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2019-20 have been uploaded on the website of the Company at www.groupmangalam.com, website of National Stock Exchange of India Limited at www.nseindia.com and website of Link Intime India Private Limited ("LIPL") i.e. <https://instavote.linkintime.co.in>.
In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 10th AGM and Annual Report 2019-20 could not be serviced, may temporarily get their email addresses registered with the Company's Registrar and Share Transfer Agent, LIPL, by clicking the link: https://linkintime.co.in/emailreg/email_register.html and follow the registration process as guided thereafter. Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 10th AGM and Annual Report 2019-20 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 10th AGM. In case of any queries, shareholder may write to the Company at cs@groupmangalam.com or to Registrar and Transfer Agent at rt.helppdesk@linkintime.co.in. Shareholders are requested to register/update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.
There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, 31st July, 2020 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.
Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with LIPL for facilitating voting through electronic means.
The remote e-voting will commence on 9:00 A.M. on Monday, 10th August, 2020 and will end on 5:00 P.M. on Wednesday, 12th August, 2020. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by LIPL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 10th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 10th AGM may also attend the 10th AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 10th Annual General Meeting.
Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Friday, 31st July, 2020, may obtain the login ID and password by sending a request at enotices@linkintime.co.in or instavote@linkintime.co.in or cs@groupmangalam.com. However, if you are already registered with LIPL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on <https://instavote.linkintime.co.in>.
In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and InstaVote user manual for Shareholders available at the Help section of <https://instavote.linkintime.co.in> or call on +91 22 4918 6000 or may write an email to rt.helppdesk@linkintime.co.in. Members may also contact Ms. Vrunda Patel, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to cs@groupmangalam.com or may call on +91 79 6161 5000 for any further clarification.
Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to instameet@linkintime.co.in or Call us: - Tel: +91 22 - 4918 6175. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Manglam Global Enterprise Limited
Sd/-
Place: Ahmedabad Vrunda Patel
Date: 22nd July, 2020 Company Secretary

GUJARAT STATE ELECTRICITY CORPORATION LTD.
Sikka Thermal Power Station,
At PO Sikka, Dist. Jamnagar-361141.
e-mail: cegstps.gsecl@gebmmail.com Website: www.gsecl.in
CIN: U40100GJ1993SGC019988

Tender Notice No. 157
Tenders are invited for (1) Work of ON line PD testing of 245KV-1200 sq. mm and 300 sq. mm XLPE Cable Termination Bushing with required Testing Equipment at Sikka-TPS. (2) Rewiring/electrification work of colony blocks at Sikka TPS Colony. (3) Work of fiber Optic Cable Splicing on As & When require basis at STPS (4) Supply of Spares for "VOLTAS" make A.C. Compressor for Service Building A.C. Plant of Unit No. 3 & 4 at Sikka TPS. (5) Supply of Colour comparator with disc and accessories for chemical laboratory at GSECL Sikka TPS. (6) Supply of "Riot Drill Equipment" for CISF Unit at Sikka TPS. (7) Supply of Cable ID/Tag printer (Ferrule printing Machine) at Sikka TPS. (8) Supply of 150 mm Wafer Type Butterfly valve for Chlorination Plant of Unit. No. 3 & 4 at STPS. (8) Supply of Gumboot for the eligible employees of STPS.
Tender documents available on GUVNL / GSECL Website www.guvnl.com / www.gsecl.in & E&P Dept.GoG: <http://guj-epd.gov.in> (for view, download and submission in hard). Vendor, Manufacturers, Contractors are requested to locate the same from above web site. Please be in touch with our above site for any future Amendment / Corrigendum
Chief Engineer (G), STPS.

DISTRICT WATER AND SANITATION UNIT
WASMO-BHARUCH
E-TENDER NOTICE NO. 12,13,14,15,16,17 OF 2020-21
Unit Manager, DWSU, Room.No.6 to 9 First floor Beside of BAUDA Office Kanbivaga, old collectore office-WASMO-Bharuch-392001 on phone no.(02642-260885) Bharuch, Dist. Bharuch are invites online tenders through E-Tendering from registered contractors in appropriate class The following details are available for the schemes under the "Jai Jee Ran Mission-Nal Se Jal" program from approved contractors of the Government Department's drinking water schemes.

Sr.No	Taluka	Village	Tender I.D	Tender Value
1	Jhagadia	Moran	418311	10,02,815.65
2	Jhagadia	Jambol	418322	1020963.27
3	Jhagadia	Dhol	418354	1252165.88
4	Jhagadia	Pora	418393	779322.89
5	Amod	Ninan	418411	671754.40
6	Amod	Pursa	418447	542716.13

Details of the above E Tendering I.D Invite The Unit Manager, District Water & Sanitation Unit, Bharuch, Phone.No.02642-260885, On behalf of Chairman Village Water and Sanitation Committee and detailed information and other details of the amount of tender fee / Earnest money deposit and works are provided by the website or by phone at the above address. Please visit website www.nprocure.com for further detail and also available at www.statetenders.com. Payments of Contract, Work order as well as payment of work bills will be done by the concerned Village Water and Sanitation Committee. Control room is functioning at the State level for rural water supply schemes Call on 24x7 Toll free No. 1916 for village level water supply scheme related suggestion or complain.
(INF/BCH/2017/2020-21)

BRUHAT BENGALURU MAHANAGARA PALIKE
Office of the Executive Engineer Project South,
South Zone Office Complex, 9th Main, 9th Cross,
Jayanagar 2nd Block, Bangalore-560011
No.: EEP(S)/E-Procu/18/2020-21 Date : 23-07-2020

INVITATION FOR TENDER (IFT)
(Two Cover System) (Through GoK e-Procurement Portal only)
The Executive Engineer, Project South, BBMP, Bengaluru on behalf of the Commissioner, BBMP invites tenders from eligible contractors for the below mentioned construction works.

Sl. No.	Name of the work	Appx. Amount Put to tender (Rs. in lakhs)	EMD (In Rs.)
1	Providing improvement works at Ram Rao layout in Ward No.163 (As per KW-3)	98.50	1,97,000/-

Calendar of events: (1) Tender documents may be downloaded from GoK e-Procurement portal <https://eprocc.karnataka.gov.in> (2) Date of submission of tender through e-procurement portal: 11.08.2020 upto 4.00 PM, (3) Date of Pre-bid meeting: 30.07.2020 at 3.00 PM at above office. (4) Date of opening of Technical Bid: 13.08.2020 at 4.30 PM. (5) Date of Opening of Financial Bid: 17.08.2020 at 4.00 PM or After Technical Bid Approval. Further details may be obtained from the above office during office hours on working days or from website <https://eprocc.karnataka.gov.in>
Sd/- Executive Engineer, Project South
"Pay development charges, help to develop Bengaluru"

Gujarat Forestry Research Foundation
Van Sanshodhan Sankul Opp. Akshardham, 'J' Road, Sector-30, Gandhinagar.
Gujarat Forestry Research Foundation is an autonomous body under Forest and Environment Department. Government of Gujarat and its main mandate is to promote research activities in the field of Forestry and Wildlife in Gujarat State. The research/study proposals for the year 2020-21 are invited from the Government/ Semi-Government/Private/Autonomous Government Institute, registered under any statutory authority as Research institutes/Universities/Agency/Foundation/ Board/Department/ Corporation in Gujarat and having technical expertise/experts in the field of forestry/Wildlife/ Ecology/Environment/Climate Change. Applications from individuals not working in aforesaid mentioned organizations will not be considered and they need not apply.
The proposals received for the year 2019-20 could not be considered due to Covid-19 pandemic situation. The applicants who had applied earlier but wish to get their proposal considered will have to apply afresh. However, proposals submitted elsewhere for grant will not be considered. Further details viz. Research topics and format for submitting the proposals, included in the Research Guideline, may either be downloaded from website <https://gfrf.gujarat.gov.in/> or collected from the office mentioned hereunder. The soft copy of proposals (MS Word file) should be submitted via mail to director@rfr@gmail.com, followed by hard copy on or before 14/08/2020 up to 6:00 pm. to the Director, Gujarat Forestry Research Foundation, Opp. Akshardham, 'J' Road, Sector-30, Gandhinagar-382030, Gujarat, Ph. No (079) 23259300.
Director
GFRF
INF/525/20-21

TAMIL NADU STATE AGRICULTURAL MARKETING BOARD
Tender Notice No. T.06DD/C/157/2020 Dated : 22.07.2020
LUMPSUM CONTRACT (Two Cover System)
For and on behalf of the Governor of Tamil Nadu, sealed tenders will be received for the following work by the Executive Engineer, Tamil Nadu State Agricultural Marketing Board, Guindy, Chennai-32, from the PWD registered contractors class I above 75.00 lakhs up to 3.00 p.m. on 25.08.2020. The tenders will be opened by the Executive Engineer on the same day 25.08.2020 at 3.30 p.m. in the presence of tenderers present at that time.

Sl. No.	NAME OF WORK	Value put to Tender Rs.in Lakhs Approx.	EMD Rs. (including GST)
1	Construction of 5000 MT Cold storage at Sular in Coimbatore District	1267.10	14,19,200/-
2	Construction of 5000 MT Cold storage at Ambathur in Thiruvallur District	1321.30	14,80,000/-

Note: 1. The Tender Schedules will be available during Office Hours upto 24.08.2020, after remitting cost of tender schedule for Rs.16,800/- including GST in the shape of D.D. in favour of CEO, TNSAMB, Chennai-32. Payable at Chennai (or) The tender schedules can also be downloaded from the websites www.tenders.in.gov.in & www.tnamb.gov.in at free of cost. 2. Further particulars can be obtained from the office of the Executive Engineer, Tamil Nadu State Agricultural Marketing Board, Guindy, Chennai-32 during office hours i.e., 10.00 am to 5.45 pm on all working days. 3. The Tender received after due date and time will be summarily rejected. 4. Period of completion 12 months for each work. 5. The revision of dates/updates will be intimated through website. If the Government of Tamil Nadu declares complete lockdown only. DIR/277/TENDER/2020 Executive Engineer, TNSAMB, Chennai - 32

GUJARAT STATE ELECTRICITY CORPORATION LIMITED
An ISO-9001-2008 Certified Company
Regd. Office: Vidyubhavan, Race Course, VADODARA - 390 007.
Tel: 0265-6612101, Fax: (0265) 2344537,
E-Mail: cegen.gsecl@gsebmmail.com, Web: www.gsecl.in
Tender Notice No. GSECL/CEG/G-I/Dispensary/PME/2021/372 for Biennial rate contract for hiring of man power/equipment with material, for periodic medical examination work at various power plants of GSECL, Corporate Office, Vadodara is put up on our Website www.gsecl.com, www.gsecl.in, and www.nprocure.com. Interested Parties may download the tender from our web site. Be in touch with our Web Site till bid opening.
Chief Engineer(Generation)

TAMIL NADU STATE AGRICULTURAL MARKETING BOARD
Tender Notice No. T.06DD/C/157/2020 Dated : 22.07.2020
LUMPSUM CONTRACT (Two Cover System)
For and on behalf of the Governor of Tamil Nadu, sealed tenders will be received for the following work by the Executive Engineer, Tamil Nadu State Agricultural Marketing Board, Guindy, Chennai-32, from the PWD registered contractors class I above 75.00 lakhs up to 3.00 p.m. on 25.08.2020. The tenders will be opened by the Executive Engineer on the same day 25.08.2020 at 3.30 p.m. in the presence of tenderers present at that time.

Sl. No.	NAME OF WORK	Value put to Tender Rs.in Lakhs Approx.	EMD Rs. (including GST)
1	Construction of 5000 MT Cold storage at Sular in Coimbatore District	1267.10	14,19,200/-
2	Construction of 5000 MT Cold storage at Ambathur in Thiruvallur District	1321.30	14,80,000/-

Note: 1. The Tender Schedules will be available during Office Hours upto 24.08.2020, after remitting cost of tender schedule for Rs.16,800/- including GST in the shape of D.D. in favour of CEO, TNSAMB, Chennai-32. Payable at Chennai (or) The tender schedules can also be downloaded from the websites www.tenders.in.gov.in & www.tnamb.gov.in at free of cost. 2. Further particulars can be obtained from the office of the Executive Engineer, Tamil Nadu State Agricultural Marketing Board, Guindy, Chennai-32 during office hours i.e., 10.00 am to 5.45 pm on all working days. 3. The Tender received after due date and time will be summarily rejected. 4. Period of completion 12 months for each work. 5. The revision of dates/updates will be intimated through website. If the Government of Tamil Nadu declares complete lockdown only. DIR/277/TENDER/2020 Executive Engineer, TNSAMB, Chennai - 32

MANGLAM GLOBAL ENTERPRISE LTD.
CIN : L24224GJ2010PLC062434
Registered Office: 101, Mangalam Corporate House, 19/B Kalyan Society, Near M.G. International School, Mithakhali, Ahmedabad-380006, Gujarat, India. Telephone: +91 79 6161 5000; Website: www.groupmangalam.com; Email: cs@groupmangalam.com

NOTICE OF THE 10TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY, RECORD DATE AND E-VOTING
NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Tenth (10th) Annual General Meeting (AGM) of the Members of Mangalam Global Enterprise Limited (Formerly known as Mangalam Global Enterprise Private Limited) will be held on Thursday, 13th August, 2020 at 11:00 A.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 10th AGM.
In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, the Notice of AGM along with Annual Report 2019-20 have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2019-20 have been uploaded on the website of the Company at www.groupmangalam.com, website of National Stock Exchange of India Limited at www.nseindia.com and website of Link Intime India Private Limited ("LIPL") i.e. <https://instavote.linkintime.co.in>.
In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 10th AGM and Annual Report 2019-20 could not be serviced, may temporarily get their email addresses registered with the Company's Registrar and Share Transfer Agent, LIPL, by clicking the link: https://linkintime.co.in/emailreg/email_register.html and follow the registration process as guided thereafter. Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 10th AGM and Annual Report 2019-20 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 10th AGM. In case of any queries, shareholder may write to the Company at cs@groupmangalam.com or to Registrar and Transfer Agent at rt.helppdesk@linkintime.co.in. Shareholders are requested to register/update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.
There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, 31st July, 2020 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.
Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with LIPL for facilitating voting through electronic means.
The remote e-voting will commence on 9:00 A.M. on Monday, 10th August, 2020 and will end on 5:00 P.M. on Wednesday, 12th August, 2020. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by LIPL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 10th AGM; and c)

THE ANUP ENGINEERING LIMITED
(Formerly Anveshan Heavy Engineering Limited)
CIN : L29306G2017PLC099085
Regd. Office: Behind 66 KV Elec. Sub-Station, Odhav Road, Ahmedabad - 382 415
T - +91 79 2287 2833, 0622, F - +91 79 2287 0642
Email : investorconnect@anupengg.com Website : www.anupengg.com

NOTICE

Pursuant to Regulation 47(1)(a) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Saturday, August 1, 2020 at Ahmedabad to consider and approve, among other items, the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the first quarter ended June 30, 2020.

The Notice of this meeting is also available on the Company's website (www.anupengg.com) and also on the Stock Exchanges' websites viz. National Stock Exchange of India Limited (www.nseindia.com) and BSE Limited (www.bseindia.com).

For The Anup Engineering Limited
Sd/-
Place : Ahmedabad
Date : 24.07.2020

Chintankumar Patel
Company Secretary

RELIANCE
Communications

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Directors of Reliance Communications Limited ("Company") will be held on Friday, July 31, 2020 inter alia for the consideration and confirmation on the Audited Financial Results (both stand-alone and consolidated) of the Company for the quarter and financial year ended March 31, 2020.

It may be noted that the Resolution Professional of the Company shall be relying solely upon the representations, clarifications and explanations provided by the directors and key managerial personnel of the Company, and shall not be carrying out any further independent verification for taking on record of the Audited Financial Results (both stand-alone and consolidated) of the Company for the quarter and financial year ended March 31, 2020.

It is hereby further informed that as per the circulars issued by the stock exchange(s) and as per the Company's Code of Conduct framed under the Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015, the trading window for dealing in the equity shares of the Company shall remain closed from April 1, 2020 to August 2, 2020 (both days inclusive).

The intimation is also available on the website of the Company, BSE Limited and National Stock Exchange of India Limited at www.rcom.co.in, www.bseindia.com and www.nseindia.com respectively.

For Reliance Communications Limited
(Company under Corporate Insolvency Resolution Process)
Sd/-
Place: Navi Mumbai
Dated: July 24, 2020

Rakesh Gupta
Company Secretary
Registered Office:
Reliance Communications Limited
H Block, 1st Floor, Dhirubhai Ambani Knowledge City, Navi Mumbai - 400 710
Tel : +91 22 30386286, Fax: +91 22 30376622
Website: www.rcom.co.in, CIN: L45309MH2004PLC147531

મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ લિમિટેડ
CIN : L24224GJ2010PLC062434
રજીસ્ટર્ડ ઓફિસ : ૧૦૧, મંગલમ સુપરટેક હાઉસ, ૧૯/બી, કસ્ટોડિયન સોસાયટી, એમ.જી. ઇન્ડસ્ટ્રિયલ ઇસ્ટ પાર્ક, મોહામળી, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત, ભારત. ફોન: ૯૧-૭૯-૭૯૬૧૬૧૧ ૭૦૦૦, Website: www.groupmangalam.com; Email: cs@groupmangalam.com

૧૦મી વાર્ષિક સાધારણ સભા, રેકોર્ડ તારીખ અને ઇ-મતદાનની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે ચાલુ વર્ષમાં કોવિડ-૧૯ ના રોગચાળાને ધ્યાનમાં રાખીને, મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ લિમિટેડ (અહીં મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) ના સભ્યોની ૧૦મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તા. ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ ૧૧:૦૦ વાગે વિડિયો કોન્ફરન્સ ("વીસી")/અન્ય ઓનલાઇન વિઝ્યુઅલ માધ્યમ ("ઓએવીએમ") દ્વારા યોજાશે, જેમાં ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસમાં જણાવ્યા મુજબના સામાન્ય વ્યવસાયો અને વિશેષ વ્યવસાયોના વ્યવહાર હાથ ધરાશે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ લિમિટેડ
CIN : L24224GJ2010PLC062434
રજીસ્ટર્ડ ઓફિસ : ૧૦૧, મંગલમ સુપરટેક હાઉસ, ૧૯/બી, કસ્ટોડિયન સોસાયટી, એમ.જી. ઇન્ડસ્ટ્રિયલ ઇસ્ટ પાર્ક, મોહામળી, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત, ભારત. ફોન: ૯૧-૭૯-૭૯૬૧૬૧૧ ૭૦૦૦, Website: www.groupmangalam.com; Email: cs@groupmangalam.com

૧૦મી વાર્ષિક સાધારણ સભા, રેકોર્ડ તારીખ અને ઇ-મતદાનની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે ચાલુ વર્ષમાં કોવિડ-૧૯ ના રોગચાળાને ધ્યાનમાં રાખીને, મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ લિમિટેડ (અહીં મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) ના સભ્યોની ૧૦મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તા. ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ ૧૧:૦૦ વાગે વિડિયો કોન્ફરન્સ ("વીસી")/અન્ય ઓનલાઇન વિઝ્યુઅલ માધ્યમ ("ઓએવીએમ") દ્વારા યોજાશે, જેમાં ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસમાં જણાવ્યા મુજબના સામાન્ય વ્યવસાયો અને વિશેષ વ્યવસાયોના વ્યવહાર હાથ ધરાશે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત મીનિસ્ટી ઓફ કોર્પોરેટ એફેર્સના, પરિચય નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિચય નંબર ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિચય નંબર ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ (સામૂહિક પોરોચી "એમસીએ પરિચનો") કોર્પોરેટ બાયટના નામવાલ્ય દ્વારા રજૂ કરાયેલા છે. તથા ડિપોઝિટરીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના પરિચય નંબર સ્લેબી / એચઓ / સીએક્ઝી / સીએમડી / સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨મી મે, ૨૦૨૦ ના અનુસાર, ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦, ઇલેક્ટ્રોનિક મોડેલમાં, ફક્ત તે કે સભ્યોને મોકલી આપવામાં આવી છે જેમના ઇ-મેઇલ સરનામ્માંથી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે. કંપનીના સભાસદો નોંધ લે કે ૧૦મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ www.groupmangalam.com પર, નેશનલ સ્ટીક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અને લિંક ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ("એલઆઇઆઇપીએલ") ("આર.ટી.એ") વેબસાઇટ https://instavote.linkintime.co.in પર અપલોડ કરવામાં આવ્યાં છે.

રિમોટ ઇ-મતદાનના સમયાંતરે નોંધાયેલા સમયમાં, તારીખ ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૦ ની સવાર ૯:૦૦ વાગે શરૂ થશે અને બુધવાર, તારીખ ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૦ ની સાંજ ૫:૦૦ વાગે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, જે સભાસદો, કટ-ઓફ તારીખ દરમિયાન શેર ધરાવતા હશે, તેઓ ઇલેક્ટ્રોનિક માધ્યમ (રિમોટ ઇ-મતદાન) દ્વારા પોતાનો મતવાપી શકે છે. આથી સભાસદો નોંધ લે છે કે, એ રિમોટ ઇ-મતદાનની સુવિધા ઉપરોક્ત દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે અને તે સમય પછી એવઆઇઆઇપીએલ ("આર.ટી.એ.") દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે અને તે સમય દરાર પર મત આપી દીધો છે, તે સભ્યને પછીથી દ્વાર બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બી) ઇ-મતદાનની સુવિધા ૧૦મી વાર્ષિક સામાન્ય સભામાં ઉપલબ્ધ કરવામાં આવશે, અને સી) જે સભ્યો ૧૦મી વાર્ષિક સામાન્ય સભા પહેલાં રિમોટ ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપી દીધો છે તે સભ્ય પાસે ૧૦મી વાર્ષિક સામાન્ય સભામાં વીસી/ઓએવીએમ દ્વારા ભાગ લેવાઈ શકે છે પરંતુ તેઓને ફરીથી મતદાન કરવા માટેના કહકાર રહેશે નહીં. 10મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં રિમોટ ઇ-મતદાન/ ઇ-મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

કોઇપણ વ્યક્તિ, એજીએમની સુચના મોકલ્યા પછી આ કંપનીના શેર મેળવે અને એજીએમની સભ્ય બને છે તથા કટ-ઓફ તારીખ, કે જે શુક્રવાર, ૩૧મી જુલાઈ, ૨૦૨૦ છે, ના રોજ શેર ધરાવે છે, તે વ્યક્તિ લોન આઇડી અને પાસવર્ડ માટેની યરજી enotices@linkintime.co.in અથવા insta.vote@linkintime.co.in અથવા cs@groupmangalam.com મોકલવીને મેળવવી શકે છે. પરંતુ જો તેમને રિમોટ ઇ-મતદાન માટે એવઆઇઆઇપીએલ ("આર.ટી.એ.") સાથે પહેલાંથી રજિસ્ટર્ડ છે, તો પછી તેમને તમારા મત આપવા માટે તમારા હાલના યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી રિમોટ ઇ-મતદાન કરી શકો છો. જો તેમને તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તેમને "પાસવર્ડ ભૂલી ગયા છો" નો વિકલ્પનો કે જે વેબસાઇટ https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ છે તે વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી રીસેટ કરી શકો છો.

ઇ-મતદાન માટેના કોઇપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભાસદો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQs") તથા ઇન્ટરવોટ વારાંધાર્તી માર્ગદર્શિકા કે જે https://instavote.linkintime.co.inના સહાય વિભાગ ઉપર ઉપલબ્ધ છે તેની સહાય લઈ શકો છો અથવા +૯૧ ૨૪૬૮ ૬૧૭૦ પર કોલ કરી શકો છો અથવા rt.helpdesk@linkintime.co.in પર ઇમેઇલ લખી શકો છો. વધુ માહિતી માટે સભાસદો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર કંપનીના કંપની સેક્રેટરી કુલદેવ પટેલ ની પાસ સંપર્ક કરી શકે છે અથવા cs@groupmangalam.comને ઇ-મેઇલ લખી શકે છે અથવા +૯૧ ૭૯ ૬૧૬૧ ૫૦૦૦ પર કોલ કરી શકે છે.

કંપનીના સભાસદો ફક્ત વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા જ 10મી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લઈ શકે છે. વાર્ષિક સાધારણ સભામાં જોડાવા માટેની સુચના 10મી વાર્ષિક સાધારણ સભાની નોટિસમાં આપવામાં આવેલ છે. જો શેરધારક/સભાસદો પાસે 10મી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્ન અથવા સમસ્યાઓ છે, તો તેમને instameet@linkintime.co.in પર ઇ-મેઇલ લખી શકો છો અથવા અમને +૯૧ ૨૪૬૮ ૬૧૭૦ ફોન નંબર પર કોલ કરી શકો છો. વીસી/ઓએવીએમ દ્વારા 10મી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેનારા સભાસદોની કોરમની ગણતરી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અંતર્ગત કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના આદેશથી
મંગલમ ગ્લોબલ એન્જીનિયરિંગ લિમિટેડ
સહી/
સ્થાન : અમદાવાદ
તારીખ : ૨૨ જુલાઈ, ૨૦૨૦

કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

Imagicaa
Imagicaa
Registered Office: 30/31, Sangdevadi, Khopoli-Pali Road, Taluka Khalapur, District Raigad 410 203, Maharashtra, India
Corporate Office: 9th Floor, Lotus Business Park, New Link Road, Andheri (West), Mumbai 400 053, Maharashtra, India
CIN: L92490MH2010PLC199925, Tel: +91 22 4068 0000, Fax: +91 22 4068 0088
Email: compliance@imagicaworld.com Website: www.imagicaworld.com

NOTICE

Pursuant to Regulation 29 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that 27th meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, July 29, 2020, inter alia, to consider and approve the Audited Standalone and consolidated Financial Results of the Company for the quarter and year ended March 31, 2020.

The said notice is also